

31st August 2024

To.

Department of Corporate Services

BSE Limited,

P J Towers, Dalal Street, Mumbai - 400 001 To.

Listing Department

National Stock Exchange of India Limited,

Exchange Plaza, 5th Floor Plot No. C/1,

G. Block Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051

Security Code: 544060

Security ID: RBZJEWEL

Symbol: RBZJEWEL

Dear Sir/Madam

Sub: Submission under Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulation")

Pursuant to Regulation 47 of the Listing Regulation, we enclose herewith the copies of the Newspaper Advertisement published regarding instructions given to shareholders for updating their email addresses in the records of the Registrar and Transfer Agent or with the Depository in "Business Standard" (English) and "Jai Hind" (Gujarati).

The same is also made available on the website of the Company at www.rbzjewellers.com

Kindly take on record the same and oblige us.

Thanking you,

For, RBZ Jewellers Limited

Heli Akash Garala Company Secretary & Compliance Officer Mem No. ACS 49256

લા-નીનાની સ્થિતિ નવેમ્બરમાં સર્જાશે છતાં વર્તમાન ભારે વરસાદમાં તેનો આંશિક પ્રભાવ

જુલાઇ-ઓગસ્ટના ભરપૂર વરસાદથી ૩૦ વર્ષનો રેકો

જેવા સ્વરૂપથી વ્યાપક તારાજી થઈ છે ત્યારે દેશમાં જૂલાઈ-ઓગસ્ટના ઓગસ્ટની સ્થિતિમાં સરેરાશ કરતા વધુ ૧૬ ટકા વરસાદ છે. વરસાદે છેલા ૩૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે.

જુલાઈ-ઓગસ્ટમાં અત્યાર સુધીમાં દેશમાં સરેરાશ ૫૮૫ મીમી વરસાદ નોંધાયો છે. મહિનો પુરો થવાને આડે હજુ એક દિવસ બાકી છે.આંકડો ૫૯૫ મીમી આસપાસ પહોંચી શકે છે.દેશમાં આ બે મહિનાનો સરેરાશ વરસાદ ૫૩૫ મીમી રહેતો હોય છે તેની સરખામણીએ ૧૧ ટકા વધુ રહી શકે છે. આ પૂર્વે ૨૦૧૯ માં જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ ૫૯૬.૧ મીમી નોંધાયો હતો અને તેમાં ૩૦ વર્ષનો રેકોર્ડ બન્યો હતો આ રેકોર્ડ આ સચીવ એમ.રાજીવને કહ્યું કે ઓગસ્ટનો વરસાદ ધારણા બહારનો છે. વખતે તૂટી શકે છે.ઓગસ્ટનો વરસાદ ધારણાથી સારો થયો છે જુલાઈમાં હવામાન મોડલો પરથી ૧૦ થી ૧૪ દિવસ નબળા હોવાનું સુચવાતું હતું.

જાણીતા હવામાન નિષ્ણાંત તથા કેન્દ્રનાં ભ્વિજ્ઞાન મંત્રાલયનાં પૂર્વ

મધ્ય ભારતમાં બે સપ્તાહનો નબળો ગાળો રહેવા છતાં ઉતર અને દક્ષિણ ઓગસ્ટમાં ૩૬ ટકાની ખાદ્ય રહી હતી ભારતમાં જોરદાર વરસાદ થયો હતો.

દેશમાં જુનથી સપ્ટેમ્બરનાં ચોમાસામાં મહતમ દર ૬૨ ટકા વરસાદ

દેશમાં જુલાઈમાં સરેરાશ કરતા ૯ ટકા ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ૧૬ ટકા વધુ વરસાદઃ હજુ બે સપ્તાહ મેઘસવારી ચાલુ રહેવાની આગાહી

જુલાઈ-ઓગસ્ટમાં જ નોંધાયો હોય છે.જોકે મોટાભાગે તેમાં તફાવત રહે છે ગત વર્ષે જુલાઈમાં સરેરાશ કરતા ૧૩ ટકા વધુ વરસાદ થયો હતો પરંતુ

વર્તમાન ચોમાસામાં લા-નીના સીસ્ટમ પર નજર રાખવામાં આવતી હતી પરંતુ હવે અમેરીકી એજન્સીએ એવુ જાહેર કર્યું હતું કે લા-નીનાની સ્થિતિ નવેમ્બરમાં જ સર્જાઈ શકશે. અગાઉ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તે ઉદભવવાની ધારણા હતી.લા-નીનાની સ્થિતિથી ચોમાસામાં વરસાદ ભરપુર થાય છે. પેસીફીકનું તાપમાન લા-નીનાની સ્થિતિના સ્તરે પહોચ્યુ નથી. છતાં સામાન્ય સ્થિતિ કરતા ઠંડુ થયુ છે અને ઓગસ્ટના વરસાદમાં ભાગ ભજવ્યાનું માની શકાય છે. દરમ્યાન હવામાન વિભાગની આગાહીમાં એમ જણાવવામાં આવ્યું છે કે હજુ આવતા બે સપ્તાહ સુધી ચોમાસાના વરસાદ માટે સંજોગો સાનુકૂળ છે અને વધુ વરસાદ થઈ શકે છે.

કન્સલ્ટન્ટની ધરપકડ કરાઈ

મહારાષ્ટ્ર: શિવાજીની તોડવાના કેસમાં પહેલી ધરપકડ

મુંબઈ, તા.૩૦ ઓપરેશન હેઠળ ધરપકડ અને આર્કિટેક્ટ જયદીપ આપ્ટે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના **શકવારે સવારે 3 વાગ્યે** નામ આપ્યા હતા.છત્રાપતિ જોયક્શિન સિંહના ફાર્મહાઉસમાં બની કેસમાં શુક્રવારે પહેલી ધરપકડ કરવામાં આવી હતી. સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટની કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી **ચેતન પાટીલની ધરપકડ** છે.કોલ્હાપુર ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે સવારે 3 વાગ્યે સિંધુદુર્ગ કેસમાં સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ કરવામાં આવી હતી. આ પછી જયદીપ આપ્ટે અને સ્ટક્ચરલ ચેતન પાટીલની ધરપકડ કરી કોલ્હાપુર પોલીસે આરોપીને હતી. પાટીલની માલવણ માલવાન પોલીસને સોંપી

કોલ્હાપુર ક્રાઈમ બ્રાન્ચે સિંધુદુર્ગ કેસમાં સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ કરી હતી

પોલીસ સાથેના સંયુક્ત દીધો.અગાઉ, પોલીસે કોન્ટ્રાક્ટર ગુણવત્તાનો તેમજ પ્રતિમાની ફોજદારી કાર્યવાહી એ ખોટું કરનારને

ન્યાય અપાવવા માટે છે, બદલો લેવા માટે નહીં: સુપ્રીમ કોટે

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે ફોજદારી કાર્યવાહીનો ઉદ્દેશ્ય ખોટું કરનારને ન્યાય અપાવવાનો છે, બદલો કે બદલો લેવાનો નથી. જસ્ટિસ જેકે મહેશ્વરી

જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે વિશ્વાસભંગના ગુનાહિત કેસની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી

અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે વિશ્વાસભંગના ગુનાહિત કેસની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ મામલામાં તેલંગાણાના પડાલા વીરભદ્ર રાવ નામના વ્યક્તિએ તેની પુત્રીના પૂર્વ સાસરિયાઓ પર લગ્ન સમયે આપવામાં આવેલ સ્ત્રીધન (પૈસા અને મિલકત) પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે.ખંડપીઠે કહ્યું કે આવા કેસોમાં સવીચ્ચ અદાલત દ્વારા विકसित न्यायशास्त्र स्त्री (पत्नी અથવા ભૂતપૂર્વ પત્ની) ના 'સ્ત્રીધન'ના એકમાત્ર માલિક હોવાના "એકમાત્ર અધિકાર" વિશે સ્પષ્ટ છે. સ્ત્રીધન એ પૈસા અને

આપવા માટે વપરાતો શબ્દ છે જે સ્ત્રીને તેના માતાપિતા, સંબંધીઓ અથવા સાસરિયાઓ તરફથી મળે છે.બેન્ચે કાયદાની સ્થાયી સ્થિતિનો પુનરોચ્ચાર કર્યા હતો કે સ્ત્રી (પત્ની અથવા ભૂતપૂર્વ પત્ની)ને 'સ્ત્રીધન' પર "એકવચન અધિકાર" અને તેના પર એકમાત્ર અધિકાર છે. રાવ દ્વારા તેમની પુત્રીના ભૂતપૂર્વ સાસરિયાઓ વિરુદ્ધ શરૂ કરાયેલા ફોજદારી કેસ અંગે, બેન્ચે કહ્યું, 'અમે આગળ જોઈ શકીએ છીએ કે ફોજદારી કાર્યવાહીનો ઉદ્દેશ ખોટાને ન્યાય આપવાનો છે. અને તે બદલો લેવો અથવા ન કરવો તે નથી.

નામ બદલેલ છે

જૂનું નામ ચિડી સાજેદાબેન મેહમુદહુસૈનથી બદલીને ચિડી સાજેદાબેન મહેમુદહુસેન કરેલ છે. બ્લોક-સી/૧૧, મોહમંદી એપાર્ટમેન્ટ, શાહઆલમ, અમદાવાદ

નામ બદલેલ છે

મેં મારું જૂનું નામ સૈયદ સિત્વતજહા બહાઉદ્દીનથી બદલીને નવું સૈયદ સિત્વત બહાઉદ્દીન રાખ્યું છે. સરનામું: ૧૧, સાજીદપાર્ક, તવક્કલ સોસાયટીની પાછળ, પોલીસ સ્ટેશનની સામે, સરખેજ, અમદાવાદ

APOLLO

GUJARAT APOLLO INDUSTRIES LTD.

CIN No. L45202GJ1986PLC009042. Regd. Off: Block No. 486, 487, 488, Mouje Dholasan, Taluka & District: Mehsana-382732.
Corp. Off: "Parishram", 5-B, Rashmi Society, Nr. Mithakhali Six Road, Navrangpura,

ad - 380009. Ph. +91-79- 26444597/98, 26564705 Web: www.apollo.co.in NOTICE OF THE EXTRA ORDINARY GENERAL

MEETING AND REMOTE E-VOTING INFORMATION The Notice is hereby given that an EGM of the Company is scheduled to be held on Saturday, September 21, 2024 at 11.00 a.m. IST at the Registered Office of the

Company, to transact the business, as set out in the Notice of EGM.

Pursuant to the provisions of Section 20 of the Companies Act, 2013 & Regulation 36 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, the Company is sending herewith Notice of EGM through electronic mode to your email address registered with your Depository Participant(s) or Registrar and Transfer Agents of the Company i.e. Link Intime India Private Limited, as the case may be in accordance with the above referred circulars of MCA & SEBI.

These documents can also be downloaded from the website of the Company. www.apollo.co.in, website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of Central Depository Services Limited (CDSL) at

The remote e-voting period commences on Wednesday, 18th September, 2024 at 9.00 a.m. and will end on Friday, 20th September, 2024 at 5.00 p.m. During this period, Members may cast their votes electronically. The e-voting module shall be disabled by CDSL thereafter.

The Members who have cast their votes by remote e-voting prior to the EGM may also attend /participate in the EGM but shall not be entitled to cast their votes again. The manner of remote e-voting is provided in the Notice of the EGM.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

In case of any queries pertaining to e-voting members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free number 1800 22 55 33.

for, GUJARAT APOLLO INDUSTRIES LIMITED Place: Ahmedabad CS Neha Chikani Shah Mem. No. A-25420 Date: 29-08-2024 Company Secretary & Compliance Officer

બીજેપી એમ.એલ.એના ફાર્મહાઉસમાંથી હથિયારોની લૂંટઃ પોલીસકર્મીઓ પકડાયા

પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લાના સેકમાઇ લેકિન્થાબી ખાતે મંગળવારે રાત્રે કથિત રીતે બનેલી હથિયાર છીનવી લેવાની ઘટનાના સંબંધમાં ચાર મણિપુર પોલીસ કર્મીઓ અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના બીજેપી ધારાસભ્ય હતી જયારે બદમાશોએ કાર્મહાઉસની રક્ષા કરી રહેલાં ત્રણ ગ્રામ સંરક્ષણ દળના જવાનો પર કાબૂ મેળવ્યો હતો અને ત્રણ એસ.એલ.આર રાઈફલ અને ચાર લોડેડ મેગેઝિન જેમાં ૮૦ જીવતા **ફરિયાદમાં કોન્ટ્રાક્ટર અને** કારતુસ છીનવી લીધાં હતાં.

ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મેરનમ કૃષ્ણદાસ, મૈબામ શંજીત સિંહ, લોંગજામ જયંતા સિંહ, ઓઈનમ બંટી સિંહ અને મૈનમ બોમ્ચા તરીકે કરવામાં આવી છે, જે ફાર્મહાઉસના કેરટેકર છે.

પોલીસે જણાવ્યું હતું કે સેકમાઈ આસપાસના લોકોને સંભવિત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો રૂપે નુકસાન પહોંચાડવાનો હતો, અને આરોપીઓને પૂછપરછ માટે ૧૦ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આરોપ મૂકવામાં આવ્યો આવ્યાં છે મણિપુર પોલીસે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ''ઉપરોક્ત ઘટનાના અનુસંધાનમાં, ૧૮ ઓગસ્ટના રોજ, છે.સિંધુદુર્ગ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ 4 ડિસેમ્બર, 2023 મણિપુર પોલીસ દ્વારા એક મોટા ના રોજ કરવામાં આવ્યું હતું, ઓપરેશનમાં આ મુજબના હથિયાર અને જ્યારે સિંધુદુર્ગમાં પ્રથમ વખત દારૂગોળો સેક્તા અવાંગ લેઇકાઈ, ઇમ્ફાલ નૌકાદળ દિવસની ઉજવણીનું પૂર્વમાં મળી આવ્યો હતો જેમાં ત્રણ ઈન્સાસ રાઇફલ્સ સાથે. આયોજન કરવામાં આવ્યું હતું.

અયોધ્યામાં પશ્ચીમ ખંગાળવાળીઃ સગીરા પર ખળાત્કાર બાદ હત્યાઃ કેમીક્લ છાંટી મૃતદેહ સળગાવ્યો

અયોધ્યા તા.૩૦ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ પર રેપ-મર્ડરની ઘટનાએ પૂરા દેશમાં ખળભળાટ મચાવ્યો છે અને આ મામલે રાજકીય પક્ષો

પણ સામસામા આવી ગયા છે. ઘટના રામનગરી છે. એક કિશોરી **પરથી માથુ ગાયબ** બિલકુલ ખતમ સાથે દુષ્કર્મ સાથે દુષ્કર્મ

નખાયેલી લાશ મળી આવી છે. જોકે યુપીમાં અયોધ્યામાં આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ એક કિશોરી સાથે ગેંગ રેપ તેમજ એક ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની

કિશોરીનું કેમીકલથી અડધુ બળેલું શબ મળી આવ્યું હતું. તેના પેટ અને છાતીમાં કપડા ખોસવામાં આવ્યા હતા. કિશોરીનું શબ એક ખંડેરમાંથી મળી આવ્યું હતું જેમાં તેનું માથુ ગાયબ હતું.

કિમાન્ડ

नोहिस

અયોધ્યાના ગોસાઈગંજ રેલવે સ્ટેનમાં ખંડેરમાં બદલાઈ ગયેલા ડાક બંગલામાં કિશોરીનું

શબ મળ્યું હતું. પોલીસના

જણાવ્યા મુજબ શબનો અડધો ભાગ પૂરી રીતે અર્ધ બળેલો ગળી ચૂકયો છે. મૃતદેહ મળ્યોઃ હાથ અને પગ ત્યારે આવી જ પેટ-છાતીમાં કપડા જ બચ્યા છે. જયારે છાતી અયોધ્યામાં બની ખોસી દેવાયા: ધડ અને

આચરી કેમીકલ છાંટી હત્યા કરી તેમાં કપડા ભર્યા હતા. જયારે માથાનો પતો નહોતો, પોલીસે શબનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે. આ સાથે જ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરવામાં લાગી ગઈ છે.

એસ.પી. અતુલ સોનકરે જણાવ્યું હતું કે પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે. પીએમ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે.

PBZ JEWELLERS LTD આર બી ઝેડ જવેલર્સ લિમિટેડ CIN: L36910GJ2008PLC053586

રજીસ્ટર કાર્યાલયઃ બ્લોક ડી, મોન્ડીયલ રિટેલ પાર્ક, રાજપથ કલળ પાસે, એસ.જી. હાઈવે ઈસ્કોન મોલની બાજુમાં, અમદાવાદ – ૩૮૦૦૫૪. Ph: 079-69135740/41 મેલ: info@rbzjewellers.com, investors@rbzjewellers.com, વેબ: rbzjewellers.com **કંપનીના શેરધારકોના ધ્યાન માટે સૂચના**

કોર્પોરેટ બાબતોના મંત્રાલય, ભારત સરકાર ("MCA") એ રપમી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સામાન્ય પરિપત્ર નં. ૯/૨૦૨૩ બહાર પાડ્યો છે અને સિક્યોરિટીઝ એન્ડ એક્સ ચેન્જ બોર્ડ ઓફ ઈક્ઠિયાએ તેના ૭મી ઑક્ટોબર ૨૦૨૩ ના પરિપત્ર ("સેબી પરિપત્ર") દ્વારા મંજૂરી આપી છે કંપનીઓ તેમની "વાર્ષિક સામાન્ય સભા" ("AGM") કેલેન્ડર વર્ષ ૨૦૨૪ માટે વિડિયો કોન્ફરન્સિંગ/અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો ("VC/OAVM") દ્વારા સામાન્ય સ્થળે

સભ્યોની ફાજરી વિના યોજી શકે છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ("અધિનિયમ"), સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર જરૂરીચાતો) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ("લિસ્ટિંગ રેગ્યુલેશન્સ") અને MCA પરિપત્રોની જોગવાઈઓના પાલનમાં, કંપનીની આગામી "વાર્ષિક સામાન્ય સભા" VC /OAVM દ્વારા યોજવામાં આવશે. કંપનીની રજિસ્ટર્ડ એફિસ મીટિંગનું સ્થળ માનવામાં આવશે.

પરિપત્રોએ કંપનીને વાર્ષિક સામાન્ય સભા અને વાર્ષિક અફેવાલની નોટિસની ભૌતિક નકલો મોકલવાની જરૂરિયાત પૂરી કરવાની મંજૂરી પણ આપી છે. તદનુસાર, તે માત્ર ઈલેક્ટ્રોનિક મોડમાં જ સભ્યોને મોકલવામાં આવે છે, જેમના ઈ-મેલ એડ્રેસ રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ્સ અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ઓ) સાથે નોંધાયેલા છે. વાર્ષિક સામાન્ય સભા સૂચનામાં મીટિંગ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ અથવા ઈ-વોટિંગ દ્વારા મત આપવા માટેની સૂચનાઓ પણ શામેલ છે. વાર્ષિક સામાન્ય સભાની સૂચના અને વાર્ષિક અફેવાલ કંપનીની વેબસાઇટ https://rbzjewellers.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ્સ એટલે કે (BSE) બોમ્બે સ્ટોક એક્સચેન્જ www.bseindia.com પર અને (NSE) નેશનલ સ્ટોક એક્સચેન્જ www.nseindia.com પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને (NSDL) નેશનલ સિક્ષ્મોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ની વેબસાઇટ www.evoting.nsdi.com પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

શેરધારકોએ કંપની/ડિપોઝીટરી સાથે ઈમેલ એડ્રેસ રજીસ્ટર/અપડેટ કરવા માટે નીચે દર્શાવેલ સૂચનાનું પાલન કરવું.

ફિઝિકલ શેરધારકો કૃપા કરીને ફોલિયો નંબર, શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન (તેમના ઈ-મેલ કરેલી નકલ (આગળ અને પાછળ), PAN (PAN કાર્ડની સ્વ-એડ્રેસને કામચલાઉ પ્રમાણિત સ્કેન કરેલી નકલ), AADHAR (આધાર કાર્ડની સ્વ-અપડેટ કરવા માટે) પ્રમાણિત સ્ક્રેન કરેલી નકલ) cs@ rbzjewellers.com પર ઇમેઇલ

તમારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી) નો સંપર્ક કરો અને તમારા ડીમેટ શેરધારકો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ (ડીપી) દ્વારા સંચારિત પ્રક્રિયા મુજબ તમારા ડીમેટ એકાઉન્ટમાં તમારું ઈ-મેલ એડ્રેસ રજીસ્ટર/સુધારો કરો.

* કંપનીમાં ફિઝિકલ મોડમાં ધરાવતા કોઈ શેરધારકો નથી. આ નોટિસ કોર્પેરિટ બાબતોના મંત્રાલય (MCA) અને સિક્યોરિટીઝ એન્ઠ એક્સચેન્જ બોર્ડ એફ ઈન્ડિયા (SEBI) ના લાગુ પરિપત્રોના પાલનમાં કંપનીના સભ્યોની માહિતી અને લાભ માટે જારી કરવામાં આવી છે. ભોર્ડના આદેશ અનુસાર

SOO: SHHEIGIE તારીખ: ઓગસ્ટ ૩૦, ૨૦૨૪

હેલી આકાશ ગરાલા કંપની સેક્રેટરી - મેમ્બરશીપ નં. : A49256

THE HOPE BANK

અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન

પાટીલને FIRમાં આરોપી તરીકે

શિવાજી મહારાજની પ્રતિમા

તોડી પાડવાના મામલામાં બે

લોકો વિરુદ્ધ FIR નોંધવામાં

કારીગર કંપનીના માલિક

કન્સલ્ટન્ટ ડૉ. ચેતન પાટીલ પર

બેદરકારી અને કામની નબળી

એચડીએક્સી બેન્ક લિમિટેડ

એચડીએક્સી હાઉસ, મીઠાખળી છ રસ્તા પાસે, નવરંગપુરા, अ**महा**पाह. क्षेत्र : (०७६) ५५३०७०००

सिक्बोरिटार्धप्रेशन એन्ड रीक्न्स्ट्रक्शन ओक् कायनान्सियव એसेट्स એन्ड એन्कोर्समेन्ट ओक् सिक्बोरिटी र्वन्टरेस्ट એन्ड, २००२ (એક्ટ)नी क्लम १३(२) अंतर्गत सिक्योरिटी ईन्टरेस्ट (એन्ફोर्समेन्ट) इत्स २००२ ना नियम उ साथे पांचतां

અહીં નીચે સહી કરનાર <mark>એચકીએફસી બેન્ક લિમિટેક</mark> (ભૂતકાળમાં **એચકીએફસી લિ.,** જેનું નામદાર એનસીએલટી-મુંબઈ ના તારીખ ૧૭ માર્ચ, ૨૦૨૩ના આદેશ મુજબ મંજુર થયેલ એકીકરણ યોજના અનુસાર **એથકીએફસી ઠોન્ક લિમિટેક** સાથે એકીકરણ થયેલ છે) ના અધિકૃત અધિકારીઓ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ૨૦૦૨ ના નિયમ૩ સાથે વાંચતા કલમ૧૩(૧૨) હેઠળ તેમને મળેલ સત્તા હેઠળ; અહીં નીચે દર્શાવેલ બોરોઅર(સી/લીગલ વારસદાર(રો) લીગલ પ્રતિનિધિ(ઓ) ને ઉપરોક્ત એક્ટ કલમ ૧ ૩(૨) હેઠળ ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવેલ છે. જે અનુસાર જે તે ડિમાન્ડ નોટિસમાં નોટિસ મળ્યા તારીખથી ૬૦ દિવસમાં નીચેની વિગતે રકમ ચુકવવા જણાવેલ છે. નીચે સહી કરનારને ઉપરોક્ત બોરોઅર(સે) લીગલ વારસદાર(રો) /લીગલ પ્રતિનિધિ(ઓ)ને છેલ્લામાં છેલ્લા જાણીતા સરનામાનાં સ્થળે આ નોટિસ ચોંટાડવાની ફરજ પડેલ. આ નોટિસોની નકલ નીચે સહી કરનાર પાસે ઉપલબ્ધ છે અને ઉપરોક્ત બોરોઅર(સ) લીગલ વારસદાર(રો)/ પ્રતિનિધિ(ઓ) જો ઈચ્છો તો તેઓ નીચે સહી કરનાર પાસેથી જે તે નકલ ઓફિસ કામકાજના દિવસોએ કામકાજના સામાન્ય સમય દરમિયાન મેળવી શકે છે.

ઉપરોક્ત બાબતના અનુસંધાનમાં આ સાથે ફરી એકવાર બોરોઅર (સે)/લીગલ વારસદાર (રો)/લીગલ પ્રતિનિધિ (ઓ) ને નોટિસ આપવામાં આવે છે કે આ નોટિસ પ્રસિધ્ધ થયાના ૬૦ દિવસમાં અહીં નીચે તેમના જેતે નામે દર્શાવેલ ૨કમ ડિમાન્ડ નોટિસમાં દર્શાવ્યા મુજબની, નીચે કોલમ(સી) માં દર્શાવેલ તારીખથી ચુકવાય તે તારીખ સુધીની ૨કમ **એથડીએફસીમાં** જમા કરાવવાની રહેશે. ઉપરોક્ત બોરોઅર(સી દ્વારા કરવામાં આવેલ લોન એગ્રીમેન્ટ અને અન્ય દસ્તાવેજો/લખાણો વાંચનમાં લેવા. લોનની બાકી નીકળતી રકમ, પરત ચુકવણીની રકમ સામે ઉપરોક્ત બોરોઅર(સ) દ્વારા **એચકોએફ્સી** સમક્ષ નીચે નિર્દિષ્ટ સિક્યોર્ડ અસ્કયામત ગિરો મૂકવામાં આવેલ છે.

બોરોઅર(સ) / કાયદેસરના વારસ (દારો) / કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નું ધ્યાન દોરવામાં આવે છે કે એક્ટની કલમ-૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઈઓ અનસાર સમય રહેતાં પોતાની સલામત અસ્ક્યામત/તો છોડાવી લે

અનુ. નં.	બોરોઅર(સી)/ગેરન્ટર(સી) કાયદેસરના વારસદાર(રો) અને કાયદેસરના પ્રતિનિધિ(ઓ)નાં નામ	કુલ બાકી લેણી રકમ	હિમાન્ડ નોટિસ તારીખ	સ્થાવર અસ્કયામત(તો) સ્થાવર મિલકતોનું વર્જ઼ન	
(એ)	(બી)	(સી)	(8)	(6)	
٩	શ્રી સુરેશચંદ ડૉરવા (બોરોઅર) શ્રીમતી સીમા દેવી (કો-બોરોઅર) શ્રી બ્રિજમોહન ડૉરવા (કો-બોરોઅર)	રા. ૩૩,૦૧,૨૦૮/- તા. ૩૧ જુલાઇ, ૨૦૨૪ ના રોજ [*]	, ,		
8	શ્રી ક્લેચાસિંઘ બી. ભદોરીયા (બોરોઅર) શ્રીમતી પ્રિયંકા કે. ભદોરીયા (કો-બોરોઅર)	રૂા. ૯,૪૨,૦૮૯/- તા. ૩૧ જુલાઈ, ૨૦૨૪ ના રોજ*	ર૪ ઓગસ્ટ, ૨૦૨૪	રો-હાઉસ-૧૦૦, ઉમંગ હોમ્સ, પ્લોટ વ્લોક-૬૪૨, ૬૪૩, સ. નં. વ્લોક-૬૪૨, ૬૪૩, શ્રીજી વહેલાલ સોસાયદી, વહેલાલ મેઇન ગેટ પાસે, નરોડા-દહેગામ રોડ, વહેલાલ, દહેગામ, અમદાવાદ-૩૮૨૩૦૫.	
3	શ્રી રાથવેન્દ્રસિંઘ ડામોર (બોરોઅર) શ્રીમતી ગીતાબેન રાઘવેન્દ્રસિંઘ ડામોર (કો-બોરોઅર)	રા. ૮,63,૪૧3/- અને રા. ૯૮,૫૨૮/- અનુક્રમે તા. ૩૧ જુલાઈ, ૨૦૨૪ ના રોજ*	ર૪ ઓગસ્ટ, ૨૦૨૪	ચુનિટ નં૧ર, ડલોક નંએ/૧૪, ગોકુલ ગેલેફ્રી રેસિડેન્સી, ડલોક નં૯૮ર, ૯૮૩, ૯૮૪, ૯૮૫, કઠવાડા તળાવ સામે, ઓફ-સરદાર પટેલ રીંગ રોડ, કઠવાડા, અમદાવાદ-૩૮૨૪૩૦.	
8	શ્રી યોગેશકુમાર પટેલ (બોરોઅર) શ્રીમતી આરતીબેન યોગેશભાઇ પટેલ (કો-બોરોઅર)	રૂા. ૧૧,૯૦,૮૧૪/- અને રૂા. ૨,૯૬,૮૩૩/- અનુક્રમે તા. ૩૧ જુલાઈ, ૨૦૨૪ ના રોજ*	ર૪ ઓગસ્ટ, ૨૦૨૪	ફલેટ-એ/૨૦૮, બીજો માળ, રાદે વંદન રેસિડેન્સી, સ. નં. ૪૧૬/૧, ૪૧૬/૨, રાદે વિલા ફલેટ્સ સામે, માર્કેટ ચાર્ડ પાસે, કનેતી રોડ પાસે, સાણંદ, અમદાવાદ-૩૮૨૧૧૦.	
ų	શ્રી રામાચઘપ્રસાદ શુકલા (બ્રોરોઅર) શ્રીમતી સાવિત્રી દેવી (કો-બોરોઅર)	રૂા. ૨૦,હર,૪હર/- અને રૂા. ૧,૯૨,૮૬૨/- અનુક્રમે તા. ૩૧ જુલાઈ, ૨૦૨૪ ના રોજ*	ર૪ ઓગસ્ટ, ૨૦૨૪	ફલેટ-એ/૧૦૪, પહેલો માળ, નિર્ગુણ એવન્યુ ફલેર્સ, સ. નં. ૭૫/૧, એફપી-૧૦૨, ટીપી-૫७, નારોલ સર્કલ-અસવાવી સર્કલ રોડ, નારોલ, અમદાવાદ-૩૮૨૪૦૫.	
ş	પત્ની/પુત્ર/પતિ/પુત્રી- શ્રી મંગલભાઈ સોમાભાઈ વાઘેલા (અવસાન પામેલ છે) અને અન્ય જાણમાં હોય/જાણમાં ના હોય	રૂા. હપ,૫७૦/- અને રૂા. હ,૨૪,હ૫७/-	રુક ઓગસ્ટ, ૨૦૨૪	ફ્લેટ-એચ/૪૦૨, ચોથો માળ, પુષ્પક-૨, ૦લોક-એચ, પ્લોટ એફપી-૩૮/૧, યુનિટ દીપી-૧૧૨, સ. નં. ૨૩૪/૨, પુષ્પક, દર્શન ધામ	

વાદોલા (અવસાન પામેલ છે) (બોરોઅર) બાકી રકમ ચૂકવાય/જમા થાય તે તારીખ સુધીમાં લાગુ પડતું ચઢતું વધારાનું વ્યાજ, પ્રાસંગિક ખર્ચા, ચાર્જિસ, અન્ય ખર્ચા, વગેરે ગક્ષતરીમાં લેવાશે.

તા. ૩૧ જુલાઈ, ૨૦૨૪

અનુક્રમે

CIN: L65920MH1994PLC080618,

તેવા કાયદેસરના વારસદાર(રો),

કાયદેસરના પ્રતિનિધિ(ઓ), અનુગામીઓ

અને અસાઈન્સ- શ્રી મંગલભાઈ સોમાભાઈ

જો ઉપર દર્શાવ્યા મજબની ચકવણી કરવામાં દેવાદારો નિષ્કળ જશે તો **એચકીએક્સી** દ્વારા ઉપરોક્ત સિક્યોર્ડ અસ્કયામત(તો)/ સ્થાયી મિલકત(તો) સામે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩(૧૪) અને લાગુ પડતા તમામ નિયમો હેઠળ કામકાજ કરવામાં આવશે. જો બોરોઅર(સી/લીગલ વાસરદાર(રો)/ લીગલ પ્રતિનિધિ(ઓ) ના ખર્ચે અને જોખમે કરાશે.

એચડીએફસી ની લેખિત પૂર્વ સંમતિ વગર ઉપરોક્ત બોરોઅર(સ)/લીગલ વારસદાર(રો)/ લીગલ પ્રતિનિધિ(ઓ)ના ઉપરોક્ત કાયદા હેઠળ ઉપરોક્ત ક્ષલામત અસ્કયામત(તો) સ્થાયી મિલકત(તો) વેચાછ્ન, લીઝ કે અન્ય કોઈપણ રીતે ટ્રાન્સફર કરી શકશે નહીં. કાયદા કે નિયમો હેઠળની જોગવાઈનું કોઈપણ વ્યક્તિ ઉલ્લંઘન કરશે કે ઉલ્લંઘન કરવા પ્રોત્સાહિત કરશે, તો તેઓ કાયદા હેઠળની જોગવાઈ અનુસાર જેલની સજા અને / અથવા પેનલ્ટીની સજાને પાત્ર ઠરશે.

વતી, એચડીએફસી બેન્ક લિ તારીખ : ૩૦-૦૮-૨૦૨૪ SIDIBHIG: DIBS અધિકૃત અધિકારી

ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ BHAGWATI

(CIN: L27100GJ1981PLC004718) રજી. ઓફિસઃ સર્વે નંબર ૮૧૬, ગામઃ રજોડા, બાવળા નજીક, અમદાવાદ-૩૮૨૨૨૦, ગુજરાત, ભારત. होनः +eq २७९४ २३२२८३/२३२e८३/२३२०५५ E-mail: cs@bhagwati.com Website: www.bhagwati.com ૪૨મી વાર્ષિક સામાન્ય સભા, રીમોટ ઈ-વોટીંગ માહિતી અને બુક ક્લોઝર અંગેની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીઝ એક્ટ ૨૦૧૩ (ધી એક્ટ) ની લાગુ પડતી જોગવાઈઓ અનુસાર અને કોર્પોટેર મંત્રાલય બાબતોનાં (એમસીએ) દ્વારા જારી કરવામાં આવેલા સમાન્ય પરિપત્રો તા. ૮ એપ્રિલ ૨૦૨૦નો જનરલ સરક્યુલર નંબર ૧૪/૨૦૨૦, કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલ તા. ૧૩ એપ્રિલ ૨૦૨૦નો સરક્યુલર નંબર ૧૭/૨૦૨૦ અને ત્યારબાદ તા. ૦૫ મે ૨૦૨૦નો સરક્યુલર નં. ૨૦/૨૦૨૦, તા. ૧૫ જૂન ૨૦૨૦નો જનરલ સરક્યુલર નં. ૨૨/૨૦૨૦ ता. २८ सप्टेम्पर २०२०नो वनरत सरड्युतर नं. ३३/२०२०, ता. ३१ डिसेम्पर, २०२०नो वनरत सरड्युतर नं ૩૯/૨૦૨૦, તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૧નો સરક્યુલર નં. ૨૧/૨૦૨૧, તા. ૧૪ ડીસેમ્બર ૨૦૨૧નો જનરલ સરક્યુલર નં. ૨૧/૨૦૨૧, તા. ૦૫ મે ૨૦૨૨નો સરક્યુલર નં. ૦૨/૨૦૨૨, તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૨નો સરક્યુલર નં. ૧૦/૨૦૨૨, તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩નો સરક્યુલર નં. ૦૯/૨૦૨૩ અને સેબી દ્વારા જારી કરવામાં આવેલ તા. ૧૧ જુલાઈ ૨૦૨૩ના માસ્ટર સરક્યુલરની કલમ ૬-જે, તા. ૦૫ જાન્યુઆરી ૨૦૨૩ના સેબી સરક્યુલર નં. સેબી/એચઓ/સીએફડી/ પીઓજી-૨/ સીઆઈઆર/૨૦૨૩/૪ અને તા. ૦૭ ઓક્ટોબર ૨૦૨૩ના પાનાં નં. ૨ના પાના નં. ૧નો સરક્યુલર નં. સરક્યુલર સેબી/ એચઓ/સીએફડી–પીઓડી–૨/પી/સીઆઈઆ૨/૨૦૨૩/૧૬૭(સામૂહિક રીતે જેનો ઉલ્લેખ સરક્યુલર્સ તરીકે કરાયેલ છે.) તેની પૂર્વતા સ્વરૂપે એક સામાન્ય સ્થળે સભાસદોની ભૌતિક (રૂબરૂ) હાજરી વગર એજીએમ બોલાવતી નોટીસમાં દર્શાવેલા કામકાજને હાથ ધરવા માટે ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડના (કંપની) સભાસદોની ૪૨મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) વિડીયો કોન્ફરન્સિંગ (વિસી) / અન્ય ઓડીયો વિઝ્યુઅલ માધ્યમ (ઓએવીએમ) દ્વારા બુધવાર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગે (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ – આઈએસટી મુજબ) યોજાશે. ફક્ત ઈ-મેઈલ મારફતે વાર્ષિક અહેવાલની સ્વાનગી

ઉપર દર્શાવેલ સરક્યુલર્સની પૂર્વતા સ્વરૂપે જેમના ઈ-મેઈલ આઈડી ડિપોઝિટરીઝ અથવા કંપની સાથે રજીસ્ટર્ડ થયેલા એવા સભાસદોને ઇલેક્ટ્રોનિક માધ્યમ મારફતે ૪૨મી એજીએમ (એજીએમ નોટિસ)ની નોટિસ અને નાણાંકિય વર્ષ ૨૦૨૩–૨૪ માટેના કંપનીનો વાર્ષિક અહેવાલ મોકલવામાં આવી રહ્યો છે. સભાસદો એ વાતની પણ નોંધ લેશો કે એજીએમની નોટિસ અને એન્યુઅલ રિપોર્ટ કંપનીની વેબસાઈટ www.bhagwati.com અને બીએસઈ લિમિટેડની વેબસાઈટ www.bseindia.com અને નેશનલ સિક્ચોરિટિઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ)ની વેબસાઈટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે.

એક્ટની કલમ ૯૧ અને કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ (કંપની રૂલ્સ)ના રૂલ-૧૦ અને સેબી (લિસ્ટિંગ) ओબ્લિગેશન એન્ડ ડિસક્લોઝર રિક્વાયરમેન્ટ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (સેબી લિસ્ટિંગ) રેગ્યુલેશન્સ)ના રેગ્યુલેશન ૪૨ને સાથે વાંચતા રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક શનિવાર, ૧૪મી સપ્ટેમ્બર, ૨૦૨૪ થી બુધવાર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૪ (બંને દિવસો સહિત) દરમ્યાન બંધ રહેશે જેની હેતુ ૩૧મી માર્ચ, ૨૦૨૪ના રોજ સમાપ્ત થચેલા વર્ષ માટેના ડિવિડન્ડ મળવા પાત્ર સભાસદોની પાત્રતા નક્કી કરવા જો તે એજીએમ ખાતે મંજુર થશે તો.

ઈ-વોટિંગ માટેની સામાન્ય સુચનાઓ

એક્ટની કલમ ૧૦૮ અને વખતોવખત સુધરાવામાં આવેલા કંપનીઝ રૂલ્સના રૂલ-૨૦ અને સેબી લિસ્ટિંગ રેગ્યલેશનના રેગ્યુલેશન ૪૪ તેમજ સેકેટરીયલ સ્ટાન્ડર્ડ-૨ને વંચાણમાં લેવાના પગલે કંપની નોટિસમાં નિર્દિષ્ટ કરાયેલા તમામ ઠરાવ (રેગ્યુલેશન્સ) પર ઈલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ મારફતે એજીએમ દરમ્યાન સભાસદોને તેમનો મત આપવા માટેના તેમના અધિકારનો ઉપયોગ કરવા માટેની સુવિધા પૂરી પડતા કંપની હર્ષ અનુભવે છે. કંપનીએ એજીએમ દરમ્યાન રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ માટેની સુવિધા એનએસડીએલ તરફથી પ્રાપ્ત કરી છે. આથી કટઓફ તારીખ અર્થાત બુધવાર, ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ જેમના નામો દર્શાવાયા છે એવા જ સભાસદો માત્ર એજીએમ દરમ્યાન રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગની સુવિધાનો લાભ મેળવવા હકદાર રહેશે.

ફિઝિક્લ સ્વરૂપમાં કે ડિમટિરિચલાઈઝ (ડિમેટ) સ્વરૂપમાં શેર ધરાવતા હોય એવા સભાસદો માટે રિમોટ ઈ–વોટિંગ સમયગાળો શનિવાર, ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના (સવારે ૯:૦૦ વાગ્યાથી) રોજ શરૂ થશે અને મંગળવાર, ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ (સાંજે ૫:૦૦ વાગ્યે) સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન કંપનીના સભાસદો નોટિસમાં નિર્દેશ કરાયેલા મુજબના કામકાજ પર ઈલેક્ટ્રોનીક માધ્યમ મારફતે તેમના મત આપી શકશે. ત્યારબાદ એનએસડીએલ દ્વારા રીમોટ ઈ-વોટિંગ મોડ્યૂલ બિન કાર્યરત કરી દેવામાં આવશે. નોટિસના ભાગરૂપે નોંધમાં એજીએમ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ મતાધિકારનો ઉપયોગ કર્યાબાદ પણ સભામાં હાજરી આપીને સામેલ થઈ શકશે પરંતુ સભા દરમિયાન તેમણે ફરીથી મત આપવા દેવામાં આવશે નહિં.

આ નોટિસ ઈ-મેઈલ કર્યા બાદ જે વ્યક્તિઓએ શેર સંપાદિત કર્યા છે અને કંપનીના સભાસદો બન્યા છે અને ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવતા લાભાર્થી માલિકોના સભાસદોના રજીસ્ટર સ્ટેટમેન્ટમાં કટઓફ તારીખે જેમના નામો દર્શાવેલા છે તેવી વ્યક્તિઓ નોટિસમાં જણાવ્યા મુજબની પ્રક્રિયાને અનુસરીને રિમોટ ઈ-વોટિંગ મારફતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

વિડિયો કોન્ફરન્સિંગ (વીસી) મારફત કે ઈલેક્ટ્રોનિક વાટિંગ માટે એજીએમમાં જોડાવા માટે એજીએમ પહેલા કે દરમ્યાન જે સભાસદોને મદદ કે સહાયની જરૂર હોય તેઓ evoting@nsdl.com પર વિનંતી મોકલીને એનએસડીએલ હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે અથવાતો ૦૨૨-૪૮૮૬૭૦૦૦ પર ફોન કરી શકે છે.

ડિવિડન્ડનું ચુકવણું અને સ્ત્રોતથી કર કપાત (ટીડીએસ)

કંપનીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ દ્વારા ૨૯મી મે ૨૦૨૪ના રોજ યોજાનારી તેમની બેઠકમાં એજીએમ ખાતે સભાસદોની મંજૂરીને આદિન ૩૧મી માર્ચ ૨૦૨૪ના રોજ સમાપ્ત થતા વર્ષ માટે રૂા. ૧૦.૦૦ની મૂળ કિંમત ધરાવતા પ્રતિ ઈક્વિટી શેર રૂા. ૨.૦૦ (માત્ર રૂ. ૨)નું (એટલે કે ૨૦ ટકા) ડિવિડન્ડ ચુકવવાની ભવામણ કરી હતી. રેકોર્ડ તારીખ એટલે કે બક ક્લોઝરની શરૂઆત પૂર્વેની તારીખે શેર ધરાવતા સભાસદો જ ફાઈનલ ડિવિડન્ડ મેળવવા માટે હક્કદર રહેશે. એજીએમ માતે એક્વખત મંજૂરી મળ્યા બાદ જેમણે ડિપોઝિટરી/આરટીએ સાથે પોતાની વિગતો અપડેટ કરાવી દે એવા સભાસદોને ૩૦ દિવસની વૈદ્યાનિક સમયમર્યાદામાં તેમના બેંક ખાતામાં ડિવિડન્ડની ૨કમ સીધી જમાં આપવામાં આવશે. ડિવિડન્ડ મેળવવામાં વિલંબ નિવારવા, સભાસદોને તેમની ડીપોઝિટરીઝ/આરટીએમાં તેમની કેવાયસી વિગતો અપડેટ કરાવી લેવા વિનંતી કરવામાં આવે છે.

સભાસદો એ વાતની નોંધ લે કે ફાઈનાન્સ એક્ટ ૨૦૨૦ દ્વારા સુધારો કરવામાં આવેલા ઈન્કમટેક્ષ એક્ટ ૧૯૬૧ (ધી આઈટી એક્ટ) અનુસાર એવો આદેશ જારી કરાયો છે કે ૧ એપ્રિલ ૨૦૨૦ બાદ કંપની દ્વારા ચુકવેલ / વિતરણ કરાયેલ ડિવિડન્ડ સભાસદોના શિર કરપાત્ર રહેશે. આથી કંપનીએ ફાઈનલ ડિવિડન્ડની ચુકવણી વખતે સ્રોતથી કરકપાત (ટીડીએસ) બિન-કપાતનો લાભ મેળવવા સભાસદોને પમી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ કે તે પહેલાં યોગ્ય વિધિવત રીતે સહી કરેલ ૧૫૭/૧૫ એચ/ ૧૦ એફ ફોર્મ્સૅ cs@bhagwati.com પર મોકલવા વિનંતી કરવામાં આવે છે. પમી સપ્ટેમ્બર ૨૦૨૪ બાદ કર નિર્ધારણ/કપાત પર મળેલ કોઈપણ સંદેશા વ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહિં.

ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ વતી.

સહી/-ડૉ. પ્રવિણ એન. ભગવતી ચેરમેન DIN: 000GEOGG

તારીખ: 30.0૮.૨૦૨૪ આગાગમાં આમદાવાદ













સોસાયટી પાસે, આશિષ સિનેમા પાછળ, ઓઢવ,

અમદાવાદ-૩૮૨૪૧૫.









PUBLIC NOTICE FOR LOSS OF SHARE
TO WHOMEVER IT MAY CONCERN
inform the Concept Dublic that following above partifications

TO WHOMEVER IT MAY CONCERN
This is to inform the General Public that following share certificate o INDUSTRIES LTD office at Plot Nos. 801, 801/25, G.I.D.C. ESTATE, PHI VAPI, VALSAD DISTRICT, GUJARAT – 396195 registered in the name of the RAM CHOUDHARY jointify with PAVAN CHOUDHARY following share of the Name of the Name of the Name of the Name of N

Folio No. Certificate No. Postrinctive No. of No. No. No. No. Prom Nos To Securities held

011237 6211 198617963 198620362

unitari | 6211 | 198617963 | 198603082 | 2400 | Rs.5 |
The Public are hereby caudioned against purchasing or dealing in any way with the above referred share certificates any claim in respect of the said share certificates should below the property of the said share certificates should be such claim with the Company of its Register and Transfer Agents. Link interies beld Prevala Limited SPT Ast, C-101, 1**Ploor, L.S.S. Mang, Without (M), Marmiba-Alvelow (TEL 1824-486800 within 1-6 gray of publication of this notion after which in Colaim with be entertained and the Company shall provided to see Provided See 1.

APOLLO GUJARAT APOLLO INDUSTRIES LTD.

NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION The Notice is hereby given that an EGM of the Company is schedu Saturday, September 21, 2024 at 11.00 a.m. IST at the Registe Company to transact the business, as set out in the Notice of EGM

Saturday, Septement 7, 1425 at 1.355 at

Sold Activating of this device is a revision of the second of the second

PBZ RBZ JEWELLERS LIMITED EWELLERS LTD CIN: L36910GJ2008PLC0.

Regd. Office: BLOCK-D, MONDEAL RETAIL PARK, NEAR RAJPATH CLUB, S.G. HIGI
BESIDE ISCON MALL, AHMEDABAD, GUJARAT, INDIA, 380054. Ph; 079-691357

NU IICE FOR ATTENTION OF SHAREHOLDERS ON "INCORPORTION" WITH THE VIRENCE OF THE COMPANY. The Ministry of Corporate Affairs, Government of India ("MCA") has issued General Cruziar Nos 87023 dated 25th September 2023 and Securities and Exchange Board of India vide its circular dated 7" October 2023 ("SEBI Circular"), have permitted the companies to hold their Annual General Meeting ("AGM") through Video Conferencing/Other Audio Visual Means ("VCIOAWT) for the Calendar Year 2024 without the physical presence of Members at a common venue. In compliance with the provisions of the Companies Act, 2013 ("ACT), SEBI (Listing Regulations") and MCA Circulars, the ensuing AGM of the Company will be held through VCI OAWT. The Registered Office of the Company shall be the deemed venue of the Meeting.

venue or ne Meeting. The Circulars have also allowed the Company to dispense with the requirement to dispatch the physical copies of Notice of the ACM and Annual Report. Accordingly the same are being sent only in electronic mode to the Members, whose e-ma addresses are registered with the Registrar and Transfer Agents or with the Depository Participant(s). The Notice of the ACM also contains the instructions for the ACM also contains the instruction of the ACM also contains th

Depository Participant(s). The Notice of the AGM lass contains the instructions to casting the vote through entote e-Volingor or Voling during the meeting. The Notice of the AGM and Annual Report will also be made available on the website of the Company at https://dispevellers.com. website of stock exchanges is a BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.bseindia.com and on the website of NSOL but www.eroling.nsd.com. www.bseindia.com and on the website of NSOL but www.eroling.nsd.com. www.bseindia.com and on the website of NSOL but www.eroling.nsd.com. shareholders may follow the instructions mentioned below:

"Physical Holding | Phesas provide Folia Mission (Institutional United Institutions (Institution United Institutions) | Phase provide Folia (Institution United Institution United Insti

om or contact at toll free number 1800 22 55 33. for, GUJARAT APOLLO INDUSTRIES LIMITED CS Neha Chikani Shah Mem. No. A-25420 Company Secretary & Compliance Officer

HDFC Bank Ltd.

Branch : HDFC Bank Limited, Trident, Race Course, Vadodara-390007. Tel. : 079-64807999

Sr. No.	Name of Borrower(s)/ Legal Heir(s)/ Legal Representative(s)	Outstanding Dues	Date of Demand Notice	Date of Possession Physical/	Description of Immovable Property(ies)/ Secured Asset(s)
(a)	(b)		(d)	(e)	(f)
1	MR. BRIJESHKUMAR PATEL (Borrower) 160560-658964971	Rs. 29,13,970/- as on 31-Mar., 2023*	24-Apr., 2023	30-Aug. 2024 Physical Possession	FLAT-202, 2ND FLOOR, PITRU PRERANA FLATS, VISHRANTI PARK, JAIN DERASAR ROAD, NIZAMPURA, VADODARA-390002
2	MR. SHANKARBHAI PARMAR (Borrower) MR. SANTDAS PARMAR (Co-Borrower) 163860-659257836 & 655537813	Rs. 74,730/- And Rs. 9,57,796/- Respectively as on 31-Aug., 2023*	26-Sep., 2023	30-Aug. 2024 Physical Possession	UNIT-SF-22, 2ND FLOOR, SHREE SIDDHESHWAR HALLMARK, S. NO. 238/1, FP-151/2, OLD PANCHAM PARTY PLOT, SAYAJI PARK, AJWA ROAD, VADODARA-390019.

tention is/are invited to the pro

copy from the under

Regd. Office: HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-40001: CIN: L65920MH1994PLC080618, Website: www.hdfcbank.com

G

GUJARAT STATE FERTILIZERS & CHEMICALS LIMITED

CIN: L99999GJ1962PLC001121

Registered Office: P.O. Fertilizemagar-391 750, Dist. Vadodara, India

Phone: (0) +91-265-2242651 Fax: +91-265-2240119

ite: www.gsfclimited.com Email ID: investors@gsfclid.com: nidhi.pillai@gsfclid.com

NOTICE OF 62²⁰ ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM), AND INFORMATION REGARDING E-VOTING, BOOK CLOSURE, DIVIDEND AND REGISTRATION / UPDATING OF DETAILS

NOTICE is hereby given that the 82" Annual General Meeting (AGM) of the Company will be held through Video Conferencing VC) / Other Audio Visual means (DAVM) on Tuesday, 24" September, 2024 at 15:00 hours (IST) pursuant to and it omposition with the provisions of the Companies Act, 2013 (Fc4) and rules made thereunder, read with and General Circula Alo G9/2023 dated 25" September, 2023, other Circulars issued by the Ministry of Corporate Affairs (MCA) from time to time and Circular No SERIHO/CEP/CEP-DA-20-PCI/RC/2023/16 dated 7" October, 2023 issued by Securities and Exchangioent of India (SEBI), to transact the business that shall be set forth in the Notice of convening the AGM ("Notice").

mpliance with the above-mentioned circulars, the Notice and the Annual Report for the FY 2023-24 including the Finan nents for the year ended 31" March, 2024 shall be sent only through electronic mode to those Members, whose e-m dresses are registered with the Company's Registrar and Share Transfer Agent (RTA) and / or Depository Participant(s). Th tice and the Annual Report for the year 2023-24 including the Financial Statements for the year ended 31th March, 2024 w slotes and the Annual Report for the year 2023-24 including the Financial Statements for the year ended 31* March, 2024 to both be made variable on the website of the Company is a www.gsfclimited.com and the websites of stock exchanges when he shares of the Company are listed it. www.bsindia.com and www.nseindia.com, and on the website of e-voting servi rovider, Central Depository Services (India) Limited (*CDSL*) at www.nseindia.com, and on the website of e-voting servi rovider, Central Depository Services (India) Limited (*CDSL*) at www.nseindia.com, when the services (India) Limited (*CDSL*) at www.nseindia.com, and an attend and participated for the CPSL*) at www.nseindia.com, when the services attendia participated for the provided in the Notice.

University of the Annual Report of the Services of the

timation of Book Closure and Dividend:

ursuant to section 91 of the Act and Regulations 42 and 47 of SEBI Listing Regulations, the Register of N ursuant to section 91 of the Act and Regulations 42 and 47 of SEB Listing Regulations, the Register of Members and Share ransfer Books of the Company will reamn icosed from Tuesday, 10° September, 2024 to Tuesday, 24° September, 2024 obtic days inclusive). The dividend of ₹ 4 per equity share of face value of ₹ 2 each for the year ended 31° March, 2024 declared, will be paid on a rafter Monday 30° September, 2024 to those Members or their mandates whose anness appear as tembers (holding shares in physical form) in the Register of Members of the Company, or as beneficial owners (holding shares electronic form), as per the beneficial ownership data to be furnished by the depositories v2. National Securities Depository mitted (NSDL) and Central Depository Services (Inda) Limited (CDSL) as of the colore of fusiness town on the Record Date and the Company of the Company of the CDSL and the CDSL and the colore of the Siness town on the Record Date and the CDSL and e. Monday, 9" Sep nber, 2024

s directed by SEBI, the dividend will be paid through electronic mode to the Members who have updated their bank acco.

stalls with their respective Depository Participants (DPs) or with the RTA. Members are requested to update their ba
cocunt details in the following manner:

In case of shares held in dematerialised form, please update the bank account details with respective DF

In case of shared held in physical mode, please register / update the bank account details at the link https://web.linkintime.co.in/EmailRegiEmail.Register.html or send an e-mail at vadodara@linkintime.co.in mentioning the Folio No. to the RTA of the Company by attaching copy of their cancelled cheque or bank passbook statement attested by the bank.

structions for joining 62nd AGM, remote e-voting and e-voting during the AGM

Members holding shares as on the cut-off date i.e. Tuesday, 17° September, 2024 (Cut-off Date) ma electronically on all the businesses as set forth in the Notice (remote e-voting or during the AGM).

The Company has engaged the services of Central Depository Services (India) Limited (CDSL) to proto Members of the Company to enable them cast votes electronically through remote e-voting and also e-voting system

The remote e-voling period commences on Friday, 20" September, 2024 at 9900 hours (IST) and ends on Mon 23" September, 2024 at 1700 hours (IST). The remote e-voling module will be disabled by CDSL for voling there A Member may participate in the AGM even after exercising his /her right to vote through remote e-voling but shall no allowed to vote again in the AGM.

Voting rights will be reckoned on the shares registered in the name of the Members as on the Cut-off Dal

rs can register their email addresses with their respective DP and / or the RTA of the Company viz Link Intir were used as the regional water elimination seeds with user response or allow or the Kind Lind Company Wit Link fillment indice.

Per Ltd. at https://linkintime.co.intelmelinage/earling register.html by entiring the dealls of Folio Not Johan Ad No Number, Certificate No (for Physical Folio sonly), Shareholder Name, PAN, Mobile Number and Email address with OTF Verification or Shareholders may send such delaits through email at yaddenda@inkintime.co.int. White Lipodenilly sending the said details, self-attested copy of PAN and copy of Aadhaar Card or Valid Passport are required to be attached.

Members holding shares in physical form can update/register their PAN, Nomination, Contact Details i.e. Postal addrewith PIN Code, Mobile number, e-mail address, bank account details (for receiving the dividend, if any, directly in their Ba Accounts through electronic mode) and Specimes Signature by providing form SSF1, ISRS-2 [ISRS form SSH 13 comple in all respects along with other required documents as prescribed in these forms by any one of the following mode --

Sending hard copy of the said forms along with required documents to the RTA at the address: Link Intime Ind Private Limited, Unit: Gujarat State Fertilizers and Chemicals Limited, C-101, 247 Park, L.B.S Marg, Vikhroli (Wes Mumbai-400083: o

In person verification (IPV) of the said forms and required documents at the office of the RTA at the address: Lir India Private Limited at B-102 & 103, Shangrila Complex, First Floor, Opp. HDFC Bank, Near Radha Krish Rasta, Akota, Vadodara - 390 020; or (iii) Through electronic mode, by downloading and filling the said forms with e-sign. The required docu

uploaded at the website of the RTA of the Company at https://web.linkintime.co.in/KYC/index.html. Procedure for uploading the documents is available at the said link.

Any person, who becomes Member of the Company after dispatch of the Notice of the meeting and holding shares as of the cut-off date i.e. Tuesday, 17^a September, 2024 may obtain USER ID and password by following e-Voting instruction given in the Notice

given in the Notice.

All grievances relating to the facility for e-voting may be addressed to Mr. Rakesh Daivi, Sr. Manager, (CDSL) Centra
Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatial Mill Compounds, N IM Joshi Mang,
Lower Perair (East), Mumbai - 400013 or send an email to helpdesk, evoting@cdslindla.com or call on 022-23058738.

Tax Deducted at Jource (TDS) on Dividend: Members may note that in terms of the income Tax Act, 16f3, as amended by
the Finance Act, 2020, dividend income will be taxable in the hands of shareholders w.e.f. 1 *April, 2020 and the Compan,
is required to deduct TDS at the prescribed rates on dividend payable to shareholders w.e.f. 1 *April, 2020 and the Compan,
for prescribed rates for various categories and the forms & documents to be submitted for non-deduction of TDS
Shareholders are requested to upload relevant documents to our RTA, by clocking the URL Link
Hallbacke Indiana, to conference the Recomposition of Sentence of the company of the com $\label{limited-bound} {\bf https://liliplweb.linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html} \ on or before the Record Date i.e. 9 between 2024 by 6:00 P.M. (IST) in order to enable the Company to determine and deduct appropriate TDS / withholding tax.$

ed to read all instructions given in the Notice for e-voting, joining the AGM through VC / OAVM and TDS

Place: Vadodara Date: 30th August, 2024

For Gujarat State Fertilizers and Chemicals Limite

TAMILNAD MERCANTILE BANK LIMITED VAPI BRANCH
Amiri Camplex, GIDC Char Rasta, Vapi-Silvassa Road, Vapi-396191, Valsad District, Gujarat, Email vapi@mbank.in

DEMAND NOTICE UNDER SECTION 13(2) OF THE SARFAESI ACT otice dated 14.08.2024 uls 13(2) of the Securitization & Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002 by the Authorized Officer of Tamilinad Mercantile Bank Ltd., Vapi Branch was sent to you calling upon repay the dues in your loan accounts with us at you rate known address which could not be served. Therefore, the ontents of the said demand notice are being published in this newspaper.

Mr Riyaz Lyshatbha Mobhanal Su Culyakatbha Mobhani Su Culyakatbha Mobhani

Deg Town invasor, temporaries and the property of the SARFAESI Act in respect of Loan Account No. 391700950100013 Sub: Demand Notice under Section 13(2) of the SARFAESI Act in respect of Loan Account No. 391700950100013 (Home Loan) availed by Mr. Riyaz Liyakathbhai Mobhani & Mr.Amir Liyakathbhai Mobhani at our Yapi Branch. Al your request, the Bank has granted through its Yapi Branch from time to time, various credit facilities to you as per the particulars mentioned in Schedule-A. You, the Bonnvers have availed the credit facilities with an undertaking to repay the said credit facilities and executed the necessary loan documents in favour of the Bank and created charge in respect of movables shown in Schedule-B.

Further No.1 of you have also created mortgage by way of deposit of title deeds in respect of the property more fully describ

Schedule-Cas security. a liability in the above loan account were duly acknowledged by you by executing balance confirmation letters and reviva ers and also other security documents from time to time. Further the loan account was personally guaranteed by No.2 o

sequent to the default committed by the borrower/borrowers in repayment of the principal debt and inferest thereon, the account, has been classified as Non-Performing Assets(NPA) as on 22.07.2024 as per the directions/guidelines server Bank of India relating to asset classifications issued from time to time. Despite repeated requests you, the Borrower failed and neglected to repay the said duest-coustanding liabilities. the Borrower's Mortgaggor Proprietor/Guarantiors are hereby valled upon but in the liability.

u, the Borrowers / Mortgagori Proprietor/Guarantors are hereby called upon by this Notice under Section 13(2) to discharge Islabilities in full to the bank and to repay a sun of Rs.9,83,100 (Rupees Nine Lakh Eighty Three Thousand and On Indred Only) a son 317,2024 to the Bank within 60 days frondset of this notice. Vou are also lable to pay future interes 12,60% with monthly rests for on the aforesaid amount together with 2% penal interest incidental expenses, cost, charges

etc.

Bank will exercise all or any of the rights detailed under Sub-Section (4) of Section 13 and under other applicable provisions on the Act if you fail to repay the Bank the aforesaid amount with future interest and all costs and expenses thereon.

You, the Bornowershordaggapt Propertion/Guarantors are restrained from transfering by very of sels, lease or otherwise, any of the above said assets more specifically mentioned in the schedule hereunder after issuance of this notice as per Section (3) the above Act and any such transfer without prior written consent of the Bank will not affect the rights of the Bank and any such transfer shall be void. y such transfer shall be void.

Be Dornwers Guarantors/Mortgagors/ Proprietor attention is hereby invited to the provisions of sub-section 8 of Section 13 the ALT in respect of time available to redeem the assets.

Ction 13(8) of the SARFAESIACL:

Where the amount of dues of the secured circlifor together with all costs, charges and expenses incurred by him is tendered the secured reduction at any time before the date of publication of notice for public auction or inviting quotations or tender for public or private treaty for transfer by way of lease, as signment or sale of the secured assets—in the secured reduction of the secured assets—in the secured reduction of the secured assets—in the secured creditor for transfer by way of lease or assignment or sale of the secured creditor for transfer by way of lease or assignment or sale of the secured creditor for transfer by way of lease or assignment or sale of the sale of the case of the secured creditor for transfer by way of lease or assignment or sale of such such each of the secured creditor for transfer by way of lease or assignment or sale of such secured assets.

This notice is issued without prejection to the Bank's right to initiate such other actions or legal proceedings as it deem necessary under any other applicable provisions of the

S. No.	Borrower Name	Nature of Facility with Account Number	Amount outstanding as on 31.07.2024	Date of Execution of Loan Documents / Last Renewal					
	Mr.Riyaz Liyakathbhai Mobhani & Mr.Amir Liyakatbhai Mobhani	Home Loan (391700950100013)	983100.00	18.04.2022					
	TOTAL		Rs.983100.00						
COLUMN TO THE PARTY OF THE PART									

SCHEDULE-C (Immovable Property) Description of the property

On EOM of Residential flat at "PARIVAR APARTMENT" wing -B, flat No 302 admeasuring 800 Sq.ft (super builtup area shuated on the 3rd Floor, Survey No 471/Apaikee 7, A Willage, Dungra Tal Vapir, Dist -Valsad, Gujarat totally value Rs.1 42 Talaks standing in the name of Mr.Ryaz Liyakathba Mobhani, Boundaries: North - By open Space, South - B Flat No.301, East -By Flat No.303, West - By Open Space

On EOM of Residential flat at "RAPICAR PARTIMENT" wing —8, flat No 303 admessuring 800 Sq.ft (super builtup area situated on the 3rd Floor, Survey No 471/Alpaikee 7, 4t Village, Dungra Tal Vapi., Dist –Valsad, Gujarat totally value Fs. 4t 27 leichts standing in the name of Mr. Riyaz Liyakathhai Mobinani. Boundaries : Norm —By open Space, South—By Faith 3.34, East—by Open Space, Mest—by Flatin 3.35. ies for Rs 50 00 lakhs and GECL limi

Note: The above properties are common for credit limits availed by M/s.Raj Industri Rs.3.85 lakhs and M/s.Raj Poly Plast for Rs.40.00 Lakhs and GECL limit of Rs.12.00 lak

ted Officer, d Mercantile Bank Ltd.,

BHAGWATI AUTOCAST LIMITED

HAGWATI (CIN: L27100GJ1981PLC004718)
Regd. Office: Survey No.816, Village: Rajoda, Nr. Bavla, Dist. Ahm

NOTICE OF 42[™] ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 42" Annual General Meeting ("AGM") of members of the Bhagwati Autocast Limited (Company) is scheduled to be held on Wednesday, 25" September, 2024 at 11:00 a.m. (IST) through Video Conferencing (VC) / Other Audio-Visual Means (OAVM") in accordance with the applicable provisions of Companies Act, 2013 (the Act) and in compliance with General Circular issued by Ministry of Corporate Affairs (MCA) General Circular No. 14/2020 dated April 08, 2020, Circular No.17/2020 dated April 13, 2020 issued by the Ministry of Corporate Affairs followed by Circular No. 20/2020 dated May 05, 2020, General Circular No. 22/2020 dated June 15, 2020, General Circular No. 33/2020 dated September 28, 2020, General Circular No. 39/2020 dated December 31, 2020, Circular No. 20/201 dated January 13, 2021, Circular No. 21/2021 dated December 14, 2021, Circular No. 02/2022 dated May 05, 2022, Circular No. 10/2022 dated December 28, 2022, Circular No 09/2023 dated September 25, 2023 and Section VI-1 of Master Circular added July 11, 2023 issued by SEBI, SEBI Circular No. SEBI/HO/CFDI /PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 and Circular No. EBI/HO/CFDI /PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 and Circular No. Page 1 of 2 CIRCULAR SEBI/HO/CFDI/PoD-2/P/CIR/2023/4 for October 07, 2023 (collectively referred as "Circulars"), to transact the businesses as set out in the Notice calling the AGM without physical presence of

Dispatch of Annual Report through E-Mail Only:

Dispatch of Annual Report through. E-Mail Unity:
In compliance with above mentioned Circulars, notice of 42" AGM ("AGM Notice") and Annual Report of the Company for the FY 2023-24 ("Annual Report"), are being sent only through electronic mode to those members whose e-mail ID are registered either with depositories or with the Company, Members may note that the Notice of AGM and Annual Report are also available on the Company's website at www.bhagwait.com and on the website of BSE Ltd at www.bseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) otina.nsdl.com.

Book - Closure:

Porsuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 (Companies Rules), and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (SEBI Listing Regulations), the Register of Members and Share Transfer Book shall remain closed from Saturday, 14" September, 2024 (to Members day, 25" September, 2024 (to Members) for the purpose of determining eligibility of members to receive dividend for the year ended on 31" March, 2024, if approved at the AGM.

approved at the AGM.

General Instructions for E-Voting:

Pursuant to Section 108 of the Act, read with Rule 20 of the Companies Rules, as amended from time to time and Regulation 44 of SEBI Listing Regulations and Secretarial Standard-2, the Company is pleased to provided its members the facility to evercise their right to vote on all the resolutions as set out in the Notice by way of electronic means i.e. through remote e-voting and e-voting during AGM. The Company have availed the facility for remote-voting and e-voting during the AGM from NSDL. Members whose name appears as on the cut-off date. Wednesday, 18" September, 2024 shall only be entitled to avail the remote e-voting and e-voting individe the remote e-voting period will commence on Saturday, 21" September, 2024 (09.00 am) and ends on Tuesday, 24" September, 2024 (05.00 pm), whether holding shares in physical form or in dematerialized form. Remote e-voting facility shall not be allowed beyond the said date and time. During this period, the members of the Company may cast their votes electronically on the businesses as mentioned in the Notice. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. Other Instructions pertaining to remote e-voting and e-voting and graving that are provided in the notes forming part of the Notice. The members may participate in the meeting even after exercising their right to vote through remote e-voting but shall not be allowed to vote again during the Memericans. meeting.
Those persons who have acquired shares and have become members of the Company after emailing of the

notice and whose names appear in the Register of Members/statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through remote e-voting by following the procedure as mentioned in the Notice.

reposariors as unicur-un unite carexecuse tien vouning rights intrough remote e-volting by following the procedure as mentioned in the Notice.

Members who need assistance before or during AGM for joining the AGM through VC or for electronic voting, can contact NSDL hedpeck kby sending a request at evoting@nesdl.com or call at: 022 -4886 7000.

Payment of Dividend and Tax Deducted at Source (TDS):

The Board of Directors of the Company at its meeting held on 29" May, 2024, recommended the payment of dividend of Rs. 2000; (Rupes Pto Nohl) per equity share of face value of Rs. 10.00; (-i.e. 20%) for the year ended 31" March, 2024, subject to approval of members at the AGM. The members holding shares on record date i.e. the date prior to the commencement of the book closure, will only be entitle to receive the final divided. The dividend, once approved by the members at the AGM, will be paid within statutory time limit of 30 days, through direct credit to the bank account of who have updated their details with depositorise/RTA. To avoid delay in receiving the dividend, members are requested to update their KYC with their depositories/RTA. Or avoid delay in receiving the dividend, members are requested to update their AYC with their depositories/RTA. Wembers may note that the income Tax Act, 1961 (the Tr Act) as amended by the Finance Act, 2020, mandates that dividends paid/distributed by the Company after 1" April, 2020 shall be taxable in the hands of members. The Company shall therefore be required to deduct tax at source (TDS) at the time of making payment of final dividend. To avail benefit of non-deduction of TDS, members are requested to send duly signed 15c/15sf1/divided. To as all benefit of non-deduction of TDS, members are requested to send duly signed 15c/15sf1/divided. To as all benefit of non-deduction of TDS, members are requested to send duly signed 15c/15sf1/divided. To as 20th 48.

Date: 30.08.2024 Place: Ahmedabad Dr. Pravin N. Bhagwa Chairm DIN: 00096799

There are no shareholders in the company holding shares in physical mode. This notice is issued for the information and benefit of the Members of the Company in compliance with the applicable circulars of MCA and SEBI. By order of the Board Place : Ahmedabad Date : 30.08.2024 Heli Akash Garala Company Secretary, Membership No.: A49256

FORM NO. INC-26 [Pursuant to rule 30 of The Companies (Incorporation) Rules, 2014 Advertisement to be published in the newspaper for change of

registered office of the company from one state to anothe Before the Central Government, North Western Region

n the matter of sub-section (4) of Section 13 of Companies Act, 2013

and clause (a) of sub-rule (5) of rule 30 of

In the matter of M/S. LUMEX DIAMOND SERVICES PRIVATE LIMITED (CIN: U36999GJ2020FTC112529) a company registered under the Companies Act, 2013 having its Registered Office at 10th Ft., Office 1007/1008, Infinity Tower, Lal Darwaja Railway Station, Surat-395003, Gujarat, India.

Notice is hereby given to the General Public that the company proposes to make application to the Central Government under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at an Extraordinary General Meeting held on Wednesday, July 31, 2024 to enable the company to change its Registered Office from "State of Gujarat" to "State of Maharashtra"

Registered Office from "State of Gujarat" to "State of Maharashtra" Any person whose inferest is likely to be affected by the proposed change of the registered office of the company may deliver either on the MCA-21 portal (www.mca.gov.ii) by filing investor complaint form or cause to be delivered or send by registered post of his / her objections supported by an affidavit stating the nature of his / her objections supported by an affidavit stating the nature of his / her dependence of the state of the state of the state of the date of the state of the address Regional Director, RCC Bhavan, Opp. Rupal Park Society, Behind Ankur Rus Stop, Narapura, Ahmedabar - 380013, Gujarat within fourteen days of the date of publication of this notice with a copy o the applicant company at its registered office at the addre-mentioned below:

'10th FL, Office 1007/1008, Infinity Tower, Laldarwaja Rail' Station, Surat - 395003, Gujarat, India.'

For and on behalf of Lumex Diamond Services Private Limited

Sagar Atulkumar Shah

DIN: 08690328

Date: 31.08.2024

中 HDFC BANK

Sd/-Nidhi Pillai Company Secretary & Vice President (Legal) ACS 15142

Date : 30-08-2024